

# **PANTH INFINITY LIMITED**

CIN: L45201GJ1993PLC114416

Reg. Office: 101, Siddh Chambers, Taratiya Hanuman Street,

Gurjar Faliya, Haripura, Surat- 395003, Gujarat

Phone No.: +91 7043999011 | Website: www.panthinfinity.com E-mail: panthcompliance@gmail.com, info@panthinfinity.com

1st June, 2023

To,

Department of Corporate Services

**BSE Limited** 

P. J. Towers, Dalal street,

Mumbai-400001, Maharashtra.

BSE Code: 539143

To.

The Compliance Department

The Calcutta Stock Exchange Limited

7, Lyons Range, Dalhousie, Kolkata-700001, West Bengal.

**CSE Code: 30010** 

Sub.: Newspaper Publication of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2023.

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a Newspaper Copy of Extract of Standalone Audited Financial Results of the Company for the Quarter and Year ended 31<sup>st</sup> March, 2023 published in "Financial Express" (English) and "Gujarat Guardian" (Gujarati) Newspaper dated 1<sup>st</sup> June, 2023.

Kindly take the same on your record and oblige.

Thanking you,

Yours faithfully,

For PANTH INFINITY LIMITED

BHUMISHA DARSHAN DADWANI

Company Secretary & Compliance Officer

ACS No.: 55492



### **EURO INDIA FRESH FOODS LIMITED**

ormerly known as Euro India Fresh Foods Private Limited) Reg. office: A-22/1, Ichhapore GIDC, Hazira-Magdala Road. Surat-394510. Guiarat. India CIN: L15400GJ2009PLC057789. Email ID: investor@euroindiafoods.com Website: www.euroindiafoods.com Phone: 0261-2913021/3041.

#### Extract of Audited Financial Results for the Quarter and year ended March 31,2023

(Rs. in Lakhs, except E							
SI. No.	Particulars	Quarter ended 31.3.2023	Quarter ended 31.3.2022	Year ended 31.12.2023	Year ended 31.12.2022		
1.	Revenue from Operations	3485	2919	14309	11667		
2.	Profit before Exceptional Items and Tax	78	88	171	217		
3.	Profit before Tax	78	88	171	217		
4.	Profit for the period	28	10	121	139		
5.	Total Comprehensive Income (after Tax)	26	35	120	164		
6.	Paid up Equity Share Capital (of Rs. 10 each)	2480	2480	2480	2480		
7.	Earnings per Equity Share						
	(a) Basic	0.11	0.04	0.49	0.56		
	(b) Diluted		-	-	-		

#### Notes:

- 1) The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meeting held on
- 2) The above is an extract of the detailed format of the financial results for the quarter and year ended on March 31, 2023 filed with Stock Exchange pursuant to Regulation 33 of the SEBI Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- 3) The full format of the financial results for the quarter and year ended March 31, 2023 are available on the Stock Exchange's website (www.nseindia.com) and the Company's website www.euroindiafoods.com.

For, EURO INDIA FRESH FOODS LIMITED

Place: Surat Date: May 31, 2023

Javnika Gandharva Company Secretary & Compliance Officer

OMKAR OVERSEAS LTD Registered Office: 304, Shoppers Plaza - V, Govt. Servant Co-Op. Hsg. Soc., Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009 Phone No.: 079-26464153 || CIN: L51909GJ1994PLC023680

Websit	e : www.omkaroverseasltd.com	E-mail : omk	aroverseas2	12@gmail.com
<b>EXTR</b>	ACT OF AUDITED STANDA	LONE FINA	ANCIAL RE	SULTS FOR
QUAR	TER AND YEAR ENDED ON	31ST MAR	RCH, 2023	(Rs. In Lakhs)
Sr		Quarter	Year	Corresponding

No	Particulars	31/03/2023 (Audited)	31/03/2023 (Audited)	3 months ended in the previous year 31/03/2022 (Audited)
H		, ,	***************************************	
1	Revenue from Operations	0.00	34.42	15.89
2	Other Income	0.66	0.66	0.00
3	Total Income from Operations	0.66	35.09	15.89
4 5	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period	-3.49	-10.15	-377.28
	before tax (after Exceptional	-3.49	-10.15	-377.28
Ļ	and / or Extraordinary items)	-3.49	-10.15	-3//.20
6	Net Profit / (loss) for the period			
	after tax (after Exceptional and / or Extraordinary items)	-3.49	-10.15	-377.02
7	Total Comprehensive Income	-3.49	-10.15	-377.02
	for the period (Comprising Profit / (loss) for the period (after tax) and other comprehensive Income			
	(after tax)	-3.49	-10.15	-377.02
8	Paid-up equity Share Capital	492.36	492.36	492.36
9	Reserves (excluding Revaluation			
	Reserve) as shown in the Audited			
	Balance Sheet of the previous year.	-	-394.71	-
10	Earnings per Share (of Rs.10/- each) (for continuing operations)			
	(a) Basic	-0.071	-0.21	-7.540 7.540
ᆫ	(b) Diluted	-0.071	-0.21	-7.540

Audited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full forma of the Audited Financial Results is available on the stock Exchange website www.bseinida.com & on company's website - www.omkaroverseasitd.com (2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 30th May, 2023.
(3) The company has adopted Indian Accounting Standard (\*IND AS\*) notified by the nistry of Corporate Affairs with effect from 1st April, 2017.Accordingly the Financia Result for the Quarter and year ended on 31st March, 2023 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

Notes: (1) The above is an extract of the detailed format of quarter and year ended

For, Omkar Overseas Limited **Bhavin Patel** 

Place: Ahmedabad Date: 31/05/2023

Company Secretary & Compliance Officer Membership No. A47572

## **PANTH INFINITY LIMITED**

(CIN: L45201GJ1993PLC114416)

Reg. Off.: 101, Siddh Chambers, Taratiya Hanuman Street, Gurjar Faliya, Haripura, Surat-395003, Gujarat Tel.: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com Extract of Standalone Audited Financial Results for

	the Quarter and Ye	the Quarter and Year Ended 31st March, 2023				
Sr.		(	uarter end	ed	Year Ended	
No.	Particulars Particulars	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
MU.		Refer note 2	(Unaudited)	Refer note 2	(Aaudited)	(Audited)
1	Total income from operations (net)	152.06	818.51	398.55	1598.73	1458.87
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(11.34)	60.32	(6.75)	86.67	(0.07)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(321.64)	60.32	(6.75)	(223.63)	5.11
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(296.39)	45.48	(0.80)	(223.54)	4.27
5	Total Comprehensive Income for the period [Comprising Profit / {Loss} for the period {after tax} and Other Comprehensive Income {after tax}]	(296.44)	45.49	(87.51)	(223.62)	(82.24)
6	Equity Share Capital (Face Value Rs.10/- each)	1848.22	1848.22	1232.50	1848.22	1232.50
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)			•	71.22	910.57
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -					
ı	(a) Basic EPS	(1.60)	0.25	-0.01	(1.21)	0.02
1	(b) Diluted EPS	(1.60)	0.25	-0.01	(1.21)	0.02

- Letters.

  The above financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 30th May, 2023. The Statutory Auditors have carried out the audit for the quarter and year ended 31st March, 2023 and issued unmodified Report thereon.
- The Standalone figures for the quarter ended March 31, 2023 and March 31, 2022 are the balancing figures between audited figures in respect of the full financial year up to March 31, 2023 and unaudited published year-to-date figures up to December 31, 2022 being the date of the end of the third quarter of financial year which were subject to limited review by the statutory
- 3. The above Audited Financial Results of the Company for the quarter and year ended March 31, 2023 have been prepared in accordance with the recognition and measurement principles laid down in applicable Indian Accounting Standards ("Ind AS") as prescribed under section 133 of the Companies Act, 2013, as amended, read with relevant rules thereunder and in terms of regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015.
- The Company has received listing approval for 61,57,228 Bonus Equity shares from CSE Limited on 11.04.2023.
- There are no Investors Complaints pending as on 31st March, 2023.
- The Company is engaged in the Business of Trading of Diamonds & Jewellery. Hence, there is no separate reporting segment in terms of Indian Accounting Standards 108. по экрывае герогипд segment in terms of indian Accounting Standards 108.

  Pursuant to the recommendation by the Board in its meeting held on May 30, 2022, and approval granted by the Shareholders of the Company on July 4, 2022 by Postal Ballot through remote e-voting, the Company has issued 61,57,228 fully paid-up bonus equity shares having face value of Rs. 10/-each in the ratio of 1:2 i. e. one bonus equity share for two fully paid up equity shares. Consequent to the bonus issue, the total paid-up share capital has increased to Rs. 18,48,22,280/- from Rs. 12,32,50,000/- Accordingly, as per Ind AS 33 - Earning per share, the calculation of basic and diluted earnings per share for a periods presented has been addusted and restated.
- The Company is not having any subsidiary, associate or joint venture; therefore, it has prepared only standalone results as consolidation requirement is not applicable to the Company.
- oningary.

  The Figures for the previous half year / year have been regrouped/reclassified, wherever necessary to confirm to current period/year classification. For PANTH INFINITY LIMITED

SENDHABHAI MAKVANA

Chairman & Managing Director DIN: 09756503 Date : 30-05-2023

# @ Finser Bajaj Housing Finance Limited

Corporate office: Cerebrum IT Park B2 Building 5th floor, Kalyani Nagar, Pune, Maharashtra 411014 Branch Office: 4th floor, RK Plaza, 409-410, R.K. Plaza, Diwalipura, Vadodara-390007. Gujarat

#### POSSESSION NOTICE

U/s 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002. Rule 8-(1) of the Security Interest (Enforcement) Rules 2002. (Appendix-IV)

Whereas, the undersigned being the Authorized Officer of M/s BAJAJ HOUSING FINANCE LIMITED (BHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notice(s) to Borrower(s)/ Co-Borrower(s)/Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) having failed to repay the amount, notice is hereby given to the Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) and the public in general that the undersigned on behalf of M/s Bajaj Housing Finance Limited, has taken over the possession of the property described herein below in exercise of the powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8-(1) of the said rules. The Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) in particular and the public in general are hereby cautioned not to deal with the below said property and any dealings with the said property will be subject to

	the first charge of BHFL for the amount(s) as mentioned he			
I	Name of the Borrower(s) / Guarantor(s)	Description of Secured Asset	Demand Notice	Date of
ı	(LAN No, Name of Branch)	(Immovable Property)	Date and Amount	Possession
	Branch: BARODA,	All that piece and parcel of the Non-	04th March 2023	29-May-23
ı	LAN: H413HHL0164033 and H413HLT0170391	agricultural Property described as:	Rs. 26,07,717/-	
ı	Borrower's: / Co – borrower's	Property bearing Flat No F/303 Adm 43.50	(Rupees Twenty	
ı	1. TEJAS DUSHYANYKUMAR PANDYA (Borrower)	Sq Mtr of Akshar Paradise situated in land	Six Lac Seven	
ı	At F-303 AKSHAR PARADISE B/H NARAYAN WADI	bearing Block No 256,257,254/A/2, R.S.	Thousand Seven	
ı	AT LDARA VADODARA	No.291, 294, 287, 288 & 293 of Village	Hundred	
ı	2. JADEJA MEENABEN KHEGARJI (Co-Borrower)	Kalali Ta & Dist Vadodara. East : FLAT	seventeen Only)	
ı	At F-303 AKSHAR PARADISE B/H NARAYAN WADI	F/302. West: INTERNAL ROAD. North:		

Sd/- Authorized Officer, Bajaj i

FLAT E/302, South: FLAT F/304

Bank of Baroda ्र विजया कि किया । प्रियम

ATLDARAVADODARA390012

Palanpurpatia Branch: G/2-5, Modern Shoppe, Beside Silver Plaza, Rander Road, Surat - 395009, Gujarat, India, Phone No. 0261-2775526, E-mail: palsur@bankofbaroda.com.com

DEMAND NOTICE (Under Sub-Section (2) of Section 13 of the SARFAESI Act, 2002)

To. Mr. Satish Maniibhai Devani & Mrs. Bhavika Satishbhai Devani Address : 46, Rudra Bunglows, Sudama Chowk, Mota Varachha, Surat - 394101.

Date: 15.05.2023

Also Property at: Flat No. C/1203, Sumeru Sky Residency, Mota Varachha, Surat - 394101. Mr. Chiragkumar Ranchhodhhai Moradiya (Guarantor).

Flat No. E-1/203, Krishna Park Appt., Sudama Chowk, Mota Varachha, Surat - 394101 Sub - Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002

ter called "The Act" A/c Mr. Satish Manjibhai Devani & Mrs. Bhavika Satishbhai Devani - Ref : Credit facilities with our Bank of Baroda, Palanpurpatia, Surat We refer to our letter dated 15.07.2019 conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above

sanction you have availed and started utilising the credit facilities after providing security for the same, as hereinafter stated. The prese ding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under Type of Facility Limit Rates of Interest 0/s as on 03.05.2023 (inclusive of interest up to 29.04.2023)

Housing Loan Rs. 25,00,000/- 8,70% Rs. 29,77,719.36 + un applied interest from thereon + Legal & other Expenses

Security Agreement with brief Description of Securities: Mortgage Property Located at All the rights, title and interest of the immovab property i.e. Flat No. 1203. Admeasuring Built up area 661.20 sq. ft. i.e. equivalent to 61.45 sq. mtrs. on the 12<sup>a</sup> Floor of Building No. C of "Sumeru Sky Residency" along with undivided proportional share admeasuring 27.63 sq. mtrs. in the land underneath the said building constructed on the land bearing O. P. No. 57, Final Plot No. 57; T. P. Scheme No. 25 (Mota Varachha), Block No. 393, Revenue Survey No. 390 of Village - Mota Varachha, Tal. Surat City, Dist. Surat in the name of Mrs. Bhavika Satishbhai Devani And Mr. Satish Manjibhai Devan and **surrounded by :- North** : Adj. intemal/Building - D**, East** : Adj. Final Plot No. 160**, South** : Adj. C.O.P**, West** : Adj. Road.

(2). As you are aware, you have committed defaults in payment of interest/installments on above loans/outstandings for the on April - 2023 and thereafter. (3). Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 10.04.2023 (mention date of classification as NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon., (4). Having regard to your inability to neet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating **Rs. 29,77,719.36 + as on 03.05.2023 + unapplied interest thereon + Legal & Other Expenses** as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of ment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note., (5). Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full., (6). We vite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior writte onsent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence pu under section 29 of the Act., (7). We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender/private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will <u>not</u> be available., (8). Please ote that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us Date: 15.05.2023, Place: Surat Authorised Officer, Bank of Baroda, Surat

### MANGALYA SOFT-TECH LIMITED

CIN-L32100GJ1992PLC017564 Regd. Office- Shop-304, "Sankalp Square-2", Nr. Delux Appartment, Nr. Kalgi Char Rasta, Jalaram Temple,

Paldi, Ahmedabad-380006 E-mail: kushal@ratnakarsecurities.com, Contact no. 079-49005200 **EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR** 

	THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023						
		S1	ANDALO	NE (	Rs. In lakhs	Except EPS)	
		3 month	s ended (Q	uarterly)	Year	ended	
Si N	Particulars	31.03.2023 Audited	31.12.2022 Unaudited		31.03.2023 Audited	31.03.2022 Audited	
1	Total Income From Operations (net)	0.00	0.00	0.00	0.00	0.85	
2	Net Profit/(Loss) for ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary Items)	(0.43)	(22.28)	(1.17)	(22.96)	(0.41)	
117	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.43)	(22.28)	(1.17)	(22.96)	(0.41)	
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.43)	(22.28)	(1.17)	(22.96)	(0.41)	
5	Total Comprehensive Income for the Period (Comprising Profit/(Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax))	(0.43)	(22.28)	(1.17)	(22.96)	(0.41)	
E	Equity Share Capital.(face value of Rs.10 each)	1000	1000	1000	1000	1000	
7	balance Sheet of previous year	-		-	(1036.31)	(1013.35)	
8	BEarning Per Share (of Rs.10 /- each) (For continuing and discontinued operations)						
I	Basic	(0.00)	(0.22)	(0.01)	(0.23)	(0.00)	
IL	Diluted	(0.00)	(0.22)	(0.01)	(0.23)	(0.00)	

1. The above is an extract of the detailed audited financial results ("Results") filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full Financial Results are available on website of Stock Exchanges (i.e. www.bseindia.com) and website of the Company (i.e. www.mangalyasofttech.in)

2. The above results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 30, 2023. For, Mangalya Soft-Tech Limited

Date: 30/05/2023

**Ajay Jayantilal Shah** Chairman & Managing Directo DIN: 00023582

## **CALLISTA INDUSTRIES LIMITED**

(Formerly known as CHPL Industries Limited) Registered Office: 44 Émpire Square, Opp. Vidhyabharti College, Baben, Ta- Bardoli, Bardoli Surat GJ 394602 CIN: L65921GJ1989PLC098109.

E-mail: chplindustries@gmail.com EXTRACT OF STATEMENT OF ANNUAL AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2022

				(Rs. In Lakhs)
SI. No.	Particulars	Current/ Quarter Year ending	Year ended figures	Corresponding 3 months ended in the previous year
		31/03/2022	31/03/2022	31/03/2021
1.	Total Income from Operations	ı	1	1
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(81.0)	(11.20)	(1.06)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.18)	(11.20)	(1.06)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.18)	(11.20)	(1.06)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(81.0)	(11.20)	(1.06)
6.	Equity Share Capital (Face Value Rs. 10/- each)	304.66	304.66	304.66
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	I		-
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	(0.01) (0.01)	(0.37) (0.37)	(0.03) (0.03)

Date: 29/05/2023

Place: Surat

The above is an extract of the detailed format of Audited Standalone Financial Results for the quarter and year ended 31st March, 2023 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Annual Financial results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's websit www.chplindustriesltd.com).

The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 29th May, 2023.

> For and on behalf o Callista Industries Limited (Formerly Known as CHPL Industries Limited)

> > Rashmi Ravi Sharma Managing Director DIN: 06618645

#### DECO-MICA LIMITED

Corporate Identify Number : L20299GJ1988PLCO10807 Regd. Office : 306, 3rd Floor, Iscon Mall, Star Bazar Building, Jodhpur Char Rasta, Ahmedabad - 380 015 EXTRACT STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

		Standalone						
Sr Vo	Particulars	Quarter ended on 31/03/2023 Audited	Quarter ended on 31/12/2022 Unaudited	Quarter ended on 31/03/2022 Audited	For the Year ended on 31/03/2023 Audited	For the Year ended on 31/03/2022 Audited		
1	Total Income from Operations (net)	1825.05	1835.68	2203.91	7907.89	7213.39		
2	Net Profit / (Loss) from ordinary activities before tax	152.97	61.47	(4.07)	329.69	289.88		
3	Net profit / (Loss) for the period after tax (after Extraordinary items)	101.99	43.68	(10.17)	228.22	202.45		
4	Other Comprehensive Income /(Loss)	(8.16)	(0.80)	(5.85)	(8.67)	(0.65)		
5	Paid Up Equity Share Capital (Face value of Rs.10/- each)	420.00	420.00	420.00	420.00	420.00		
	Reserve (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)			_				
7	Earnings Per Share (Before & After extraordinary items) (Face Value of Rs.10/- each)							
	Basic : EPS (Rs.)	2.43	1.04	(0.24)	5.43	4.82		
	Diluted : EPS (Rs.)	2.43	1.04	(0.24)	5.43	4.82		
N	Note : (1) The above is an extract of the detailed format of Standalone Audited Financial Results filed with the Stock							

Note: (1) The above is an extract of the detailed format of standardie Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEB (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 The full format of the Standalone Audited Financial Results are available on the Stock Exchange websites a www.bseindia.com and on Company's website at www.decomicaltd.com
(2) The above Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors

in their meeting held on Tuesday, 30th May 2023

By Order the Board of Directors For, DECO-MICA LIMITED Mr. Vijaykumar D. Agarwal (Managing Director & CEO - DIN No : 01869337) Place: Ahmedabad Date: 30/05/2023

Regd. Office: 9th Floor, Antriksh Bhawan, 22, K.G. Marg, New Delhi-110001 Phones: 011-23357171, 23357172, 23705414, Website: www.pnbhousing.com

Date of

Description of the

**pnb** Housing Branch Office: 305-308, Third Floor, Titanium Square, Adajan Char Rasta, Adajan, Surat, Gujrat - 395009

# POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES) Whereas the undersigned being the Authorised Officer of the PNB Housing Finance Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets & in compliance of Rule 8(1) of Enforcement of Security Interest Act, 2002, and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued demand notice/s on the date mentioned against each account calling upon the respective borrower/s to repay the amount as mentioned against each account within 60 days from the date of notice(s)/ date of receipt of the said notice/s.

The borrower/s having failed to repay the amount, notice is hereby given to the borrower/s and the public in general that the undersigned has take possession of the property/les described herein below in exercise powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned against each account.

The borrower/s in particular and the public in general is hereby cautioned not to deal with the property/ies and any dealing with the property/ies will be subject to the charge of PNB Housing Finance Ltd., for the amount and interest thereon as per loan agreement. The borrowers' attention is invited to provisions of Sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Date of

No.	Account No.	Borrower/Co-Borrower /Guarantor	Demand Notice	Outstanding	Possession Taken	Property Mortgaged
1.	HOU/SRT/ 0517/388004 B.O.: Surat	Maheshbhai Laljibhai Dobariya, Nikunjkumar L Dobariya, Narmadaben Laljibhai Dobariya	16-11-2022	Rs. 20,18,361.42 (Rupees Twenty Lakhs Eighteen Thousand Three Hundred Sixty One and Forty Two Paisa Only) as on 16-11-2022.		316, Kumkum Bungalows, Olpad Road, Sandhiyer Gam, <b>Olpad, Surat,</b> <b>Gujarat-394540, India</b>
2.	HOU/SRT/ 1119/754088 B.O.: Surat	Arunaben Anandbhai Olpadi & Chirag Olpadi	11-10-2022	Rs. 8,87,715.04 (Rupees Eight Lakhs Eighty Seven Thousand Seven Hundred Fifteen And Four Paisa Only) as on 09-10-2022	27-05-2023 (Physical)	Plot No. 109, Radhe Residency, Nr. Atodra Chowkdi, Nr. Gruham Exotica, Olpad, Surat, Gujarat-394540, India
3.	HOU/SRT/ 0217/356761 B.O.: Surat	MANOJKUMAR V BALAR & ASHABEN BALAR	16-02-2019	Rs. 16,66,793.90/- (Rupees Sixteen Lakhs Sixty Six Thousand Seven Hundred Ninety Three & Ninety Paise Only) as on 16-02-2019		Plot No. B 9, Hari Darshan Residency, Nr. Shrungal Textile Park, Valenja- Shekhpur Road, <b>Shekhpur, Surat,</b> <b>Gujarat-394250</b> India
4.	HOU/SRT/ 0118/479988 B.O.: Surat	Yogeshkumar H Makwana, Ashok Hamirbhai Makvana, Ratanben Makvana	21-02-2019	Rs. 15,02,701.70/- (Rupees Fifteen Lakhs Two Thousand Seven Hundred One & Seventy Paise Only) as on 21-02-2019		Plot No. 320 as per, Plan Plot No 321, Paikee and 322 Paikee, Sundarvan Residency, Nr. Gokuldham Society, Nansad Gam Road, Nansad Kamrej, Surat, Gujarat-394180, India
- N	DI AGE, CUIDAT DATE, 04 05 0000 AUTUODIZED OFFICED DND HOUGING FINANCE LTD					

| PLACE:- SURAT, DATE:- 31-05-2023 AUTHORIZED OFFICER, PNB HOUSING FINANCE LTD.

### **CALLISTA INDUSTRIES LIMITED**

(Formerly known as CHPL Industries Limited)

Registered Office: 44 Empire Square, Opp. Vidhyabharti College, Baben, Ta-Bardoli, Bardoli Surat GJ 394602

CIN: L6592IGJ1989PLC098109, E-mail: chplindustries@gmail.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30™ SEPTEMBER, 2021

(Rs. in Lakhs)

SI.	Quarter		r Ended	Half Year Ended	Year Ended
No.	Particulars	30.09.2021	30.09.2020	30.09.2021	31.03.2021
		Unaudited	Unaudited	Unaudited	Audited
ī.	Total Income from Operations	-	-		-
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(0.24)	(0.06)	(10.84)	(1.24)
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(0.24)	(0.06)	(10.84)	(1.24)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(0.24)	(0.06)	(10.84)	(1.24)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(0.24)	(0.06)	(10.84)	(1.24)
6.	Equity Share Capital (Face Value of Rs. 10/-)	304.66	304.66	304.66	304.66
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-
8.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	(0.01) (0.01)	(0.00) (0.00)	(0.36) (0.36)	(0.04) (0.04)

The above is an extract of the detailed format of quarter and half year ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and half year ended Financial Results are available on the websites of the Stock Exchange(s) and the The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in

The Impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.
 The financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS') prescribed under section 133 of the Companies Act, 2013 read with relevant rules thereunder and in terms of Regulation 33 of the SEBI (listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended) and SEBI circular dated 05th July, 2016

The above results have been reviewed and recommended to the Board of Directors by the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held on 29th May, 2023. These results have been subjected to limited review by statutory auditors who have expressed an unqualified opinion.

Callista Industries Limited (Formerly Known as CHPL Industries Limited)

Date: 29/05/2023

Place: Ahmedabad



**HERO FINCORP LIMITED** CIN: U74899DL1991PLC046774 d Office: 34, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Tel: 011-49487150 Fax: 011-49487150 Email: litigation@herofincorp.com Regd Office: 34, Comn

Website: www.herofincorp.com

"APPENDIX-IV-A" [SEE PROVISO TO RULE 8(6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY IN TERMS OF SECURITISATION AND

RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH

PROVISO TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrowers (B) that the below mentioned immovable property mortgaged / charged to the Secured Creditor (Hero Fincorp Limited), the physical possession of the below mentioned ble property has been taken by the Authorized Officer of Secured Creditor (Hero Fincorp Limited), will be sold on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" & "Without recourse Basis" on below mentioned date for recovery of amount as mentioned below, due to the Secured Creditor from the Borrower. The Reserve Price is mentioned pelow and the earnest money to be deposited is mentioned respectively. Address of the Security Reserve Price

Name of the Borrower (B) / Guarantors (G) / with Address	charged covered under Auction	(RP)
1. M/s Vkalp Consultancy Pvt. Ltd. Having its registered office at: F-9,	Commercial Property bearing	Rs.58,00,000/-
First Floor, Jaldarshan Co-op HSL Ltd., Nr. HK College, Opp. Natraj Theater, Ellisbridge, Ahmedabad-380006 <b>Also at:</b> B-21, Vishal Tower, Anandnagar, Cross Road Satellite, Ahmedabad City,	Floor, in the scheme known as "Relief Arcade", situated City	10% of the Reserve Price
2. Mr. Kalpesh Hasmukhbhai Chauhan R/O B-21, Vishal Tower,		
Anandnagar, Cross Road Satellite, Ahmedabad City, Ahmedabad, Gujarat-380015 3. Mrs. Vidya Kalpesh Hasmukhbhai Chauhan R/O B-21, Vishal	Ahmedabad - 380001	Incremental Amount
Tower, Anandnagar, Cross Road Satellite, Ahmedabad City, Ahmedabad, Gujarat-380015		Rs.50,000/-

Outstanding Dues for recovery of which property is being sold	Date/Time of On-Site Inspection of Property with Name of Authorized Officer	Last Date for submission of EMD and Request letter of participation, KYC, Documents, Pan Card, Proof of EMD etc.	Date and Time of E-Auction with auto extension of 5 minutes each
Rs.1,16,52,648.69/- (Rupees One Crore	On or before 23.06.2023	On or before 26.6.2023	27.06.2023
Sixteen Lakhs Fifty Two Thousand Six	10.00 AM to 5.00 PM	upto 5.00 PM and EMD	Time: 10.00 AM
Hundred and Fourty Eight and Sixty	Authorized Officer: Mr. Avadhut Nalge	through RTGS/NEFT	to 1.00 PM
Nine Paisa only) due as on 25.06.2020	Mob: 9711037326	400	
along with interest and other charges.	Email: avadhut.nalge@herofincorp.com		

The Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS / NEFT or by way of Demand Draft / Pay order in the Account No.00030310016156, Name of the Beneficiary: "Hero Fincorp Limited", IFSC Code: HDFC0000003

E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" & "Without reco Basis" and will be conducted "online".

- The E-Auction will be conducted through M/s E-Procurement Technologies Ltd. (Helpline No(s): 07961200576/544/594. 596/531/583/569, 6351896643 and E-mail on support@auctiontiger.net/ maulik.shrimali@auctio portal https://sarfaesi.auctiontiger.net.
- There is no encumbrance on the property which is in the knowledge of Secured Creditors. However, the intending bidders should make their own independent enquires regarding the encumbrances, title of property put on auction and claims/rights/dues/affecting the property, prior to submitting their bids. In this regard, the E-Auction advertisement does not onstitute and will not be deemed to constitute ant commitment or any representation of Hero Fincorp Limited. The Authorized Officer / Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. The

sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: https://sarfaesi.auctiontiger.net.

Ahmedabad

**Hero Fincorp Limited** 

#### કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

(सिક्युरीटी र्घन्टरेस्ट એन्ફोर्समेन्ट इस्स,२००२न। नियम ८(९) मुष्प) આથી નીચે સહી કરનાર **ટાટા કેપીટલ હાઉસિંગ ફાઇનાન્સ લિમીટેડ**ના અધિકૃત અધિકારીને સિકચુરીટાઇપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ , २००२ ( એક્ટ ) સાથે વંચાણે લેતા સેક્શન ૧૩ (૧૨) સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ ,૨૦૦૨ (રૂલ્સ) ના રૂલ ૩ અંતર્ગતપ્રાદ અધિકારો મુજબ નીચે જણાવેલી તારીખે જારી કરાચેલી વિગતવાર ડિમાન્ડ નોટીસ નીચે જણાવેલ દેવાદારોને મોક્લવામાં આવી હતી જે મુજબ તેમણે નોટીસની તારીખથી ૬૦ દિવસમાં બાકી લેણી રકમ ચુકવી દેવાની હતી.

દેવાદાર એમ કરવામાં નિષ્ફળ નિવડયા હોઈ દેવાદારોને ખાસ તથા જાહેર જનતાને આ નોટીસર્થ <u>જાણ કરવામાં આવે છે કે નીચે જણાવેલી મિલકતનો</u> કબજોનીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ તેમને એક્ટના ખંડ ૧૩ (૪) અને કથિત રૂલ્સના રૂલ ૮ હેઠળ મળેલા અધિકાર મુજબ લીધો છે. ખાસ દેવાદાર અને જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે સદર મિલકતો ઉપર ટાટ કેપીટલ હાઉસિંગ ફાઈનાન્સ લિમીટેડના અધિકારો નીચે જણાવેલ બાકી લેણી રકમ તથા ત્યારબાદના ચડત વ્યાજ અને ખર્ચ તથા ચાર્જિસની રકમ સામે છે જેથી એનો કોઈ પણ રીતે સોદે કરી શકાશે નહીં. વધારાનું વ્યાજ,દંડનું વ્યાજ,ખર્ચ,કિંમત વગેરે નોટીસની તારીખથી ગણાશે. આથી દેવાદારોનું ધ્યાન ખેંચવામાં આવે છે કે એક્ટ ના ખંડ ૧૩ ના પેટા ખંડ (૮) હેઠળ તેમને ગીરો મકેલી મિલકત છોડાવવાનો સમય હજ છે.

લોન ખાતા નંબર	हेवाहार(रो), कानूनी वारसहार(रो), कानूनी प्रतिनिधि(ओ) ना नाम	ડીમાન્ડ નોટીસ મુજબની રકમ	ડીમાન્ડ નોટીસની તારીખ કબ્જાની તારીખ	કબજાનો પ્રકાર
10603553	શ્રી ભરત મુંદ્રીકા દાસ (દેવાદાર), શ્રીમતી સરીતા ભરત દેવી (સહ દેવાદાર)	Rs. 10,95,464/-	19-12-2022 29-05-2023	સાંકેતિક કબજો

સુરક્ષિત સંપત્તિ/સ્થાવર મિલકત/ગિરો મિલકતનું વર્ણન : તમામ ખંડ અને અખંડિત ભાગ ધરાવતી સ્થાવર મિલકત રહેણાંક ફ્લેટ નં.૧૦૧,સુપર બિલ્ટઅપ એરિયા ક્ષેત્રફળ ७३५.०० ચો.ફૂટ અથવા ૬૮.૨૮ ચો. મી.ની સાથે ૧૦.૦૦ ચો.મી સાંઈ સમર્પણ રેસીડેન્સીની અવિભાજિત જમીનનો ભાગ તથા આંતરીક અને બાહ્ય ઉપયોગના અધિકારો ,પહેલા માળે ,બિલ્ડીંગ 'બી' પ્લોટ નં.પ ક્ષેત્રફળ અંદાજે ફલ્પ.ફલ્ ચો.મી. બિનખેતી જમીન રે.સ.નં.૧૧૯/૫, ક્ષેત્રફળ ૪૧,૮૮૫ ચો.મી., મોજે ગામ ચંદો૨, તા.વાપી, જિ.વલસાડ,ગુજરાત **ચતુઃસીમા** : પૂર્વે : દાદ૨,પશ્ચિમેઃ ફ્લેટ નં .૧૦૨,ઉત્તરેઃ પેસેજ ,દક્ષિણેઃ આંતરીક રોડ

TCHHL0264000 100061922 & TCHIN0264000	દિનેશ બિહારી સિંઘ (દેવાદાર), સંજુ દિનેશ સિંઘ (સહ દેવાદાર)	&	18-02-2023 29-05-2023	સાંકેતિક કબજો
100123507	1 (1 0)	4.28.891/-		

सुरक्षित संपत्ति/स्थावर भिवङत/शिरो भिवङतनुं वर्धन : तमाम अंड અને અખંડિત ભાગ ધરાવતી સ્થાવર મિલકત રહેણાંક ફ્લેટ નં.ઈ-3/306,બિલ્ટઅપ એરિયા ક્ષેત્રફળ ૪७૫.૦૦ ચો.ફૂટ અથવા ૪૪.૧૪ ચો. મી.ત્રીજા માળે,બિલ્ડીંગ ઈ-3' શિવમ વિહાર બિનખેતી જમીન રે.સ.નં. ૧७૫/૪/૧૨, ક્ષેત્રફળ ૨૩,૪७૧.૦૦ ચો.મી.,મોજે સોળસુંબા, તા.ઉબરગાંવ જિ. વલસાડ, ગુજરાતની સાથે ૧૦.૦૦ ચો.મી. કથિત મિલકતની અવિભાજિત જમીનનો ભાગ તથા આંતરીક અને બાહય ઉપયોગના અધિકારો **ચતુઃસીમાઃ** પૂર્વેઃફ્લેટ નં.ઈ-3/3૦૮, પશ્ચિમેઃખુલ્લી જગ્યા,ઉત્તરેઃ આંતરીક રોડ,દક્ષિણે:ફ્લેટ નં.ઈ-3/30ફ

8 29-05-2023 24,462/-	કબજો

સુરક્ષિત સંપત્તિ/સ્થાવર મિલકત/ગિરો મિલકતનું વર્ણન : તમામ ખંડ અને અખંડિત ભાગ ધરાવતી સ્થાવર મિલકત રહેણાંક ફ્લેટ નં.સી-૨/૪૦૨, બિલ્ટઅપ એરિયા ક્ષેત્રફળ ૫૧૧.૦૦ ચો.ફૂટ અથવા ૪७.૪૯ ચો. મી. (સુપર બિલ્ટઅપ એરિયા ७૫૫.૦૦ ચો.ફૂટ અથવા ૭૦.૧૬ ચો.મી.) ચોથા માળે,બિલ્ડીંગ 'સી-૨' શિવમ વેલી બિનખેતી જમીન પરનું બાંધકામ, રે.સ.નં.૨૧૧/૨/૩ પૈકી ૧(નવો સ.નં.૨૮૫) ક્ષેત્રફળ ૫૪૧૩.૦૦ ચો.મી. ગામ ભીલાડ,તા.ઉબ૨ગાંવ,િજ. વલસાડ ની સાથે ૧૦.૦૦ ચો.મી. કથિત મિલકતની અવિભાજિત જમીનનો ભાગ તથા ટાઈટલ,હિતો અને અન્થ અધિકારો **ચતુઃસીમા** : પૂર્વે : ફ્લેટ નં.સી-૧/૪૦૨, પશ્ચિમેઃ ફ્લેટ ન સી-૨/૪૦૧, ઉત્તરેઃ ખુલ્લી જગ્યા, દક્ષિણેઃ ફ્લેટ ન સી-૨/૪૦૩

9173815	કિશોર ઈન્દાસ પાટીલ (દેવાદાર), જચોતિ કિશોર પાટીલ ( સહ દેવાદાર)	Rs. 10,11,435/-	24-02-2023 29-05-2023	સાંકેતિક કબજો
---------	---	--------------------	--------------------------	------------------

સુરક્ષિત સંપત્તિ/સ્થાવર મિલકત/ગિરો મિલકતનું વર્ણન : તમામ ખંડ અને અખંડિત ભાગ ધરાવતી સ્થાવર મિલકત રહેણાંક કલેટ નં.એ-૪૦૬, ચોથા માળે બિલ્ડીંગ નં.'એ' સુપર બિલ્ટઅપ એરિયા ક્ષેત્રફળ ૧૦૦૦ ચો.ફૂટ અથવા ૯૨.૯૩ ચો.મી.ની સાથે ૧૨.૦૦ ચો.મી. નંદન વન એપાર્ટમેન્ટની અવિભાજિત જમીનનો ભાગ તથા આંતરીક અને બાહ્ય ઉપયોગના અધિકારો,બિનખેતી જમીન રે.સ.નં ૨૨૫/પૈકી ૧,૨૨૫/પૈકી ૪, ક્ષેત્રફળ ૧૬૫૮ ચો.મી., મોજે હરીયા પાર્ક, ડુંગરા વાપી તા.પારડી, જિ. વલસાડ, ગુજરાત **ચતુઃસીમા** : પૂર્વે : ફ્લેટ નં.એ-૪૦७, પશ્ચિમેઃ ਦੇ। ਤੇ, ਉਹਦੇ: ਦੀਤ, દક્ષિણੇ: ਪੌਲੇਕ

તારીખ : ૨૯-૦૫-૨૦૨૩ ક્થળ : ગુજરાત

Name of SB/AP

Place : Gujarat

Bhaveshkumar

Place : Guiarat

Date : 01.06.2023

વતિ.ટાટા કેપીટલ હાઉસિંગ કાઈનાન્સ લિમીટેડ

Trade Name of NSE FO BSE Reg. MCX Reg.

AP0397505691

AP0397 308061

we will not be liable in any manner for any consequence of such dealings/deals

Dasharathsinh

Name of SB/AP Trade Name of SB/AP NSE FO Reg. No.

Bhaveshkumar

**Particulars** 

2 Earnings before Interest Depreciation and Tax

Net Profit / (Loss) for the period (before Tax.

Exceptional and/or Extraordinary items)

Net Profit / (Loss) for the period before tax

Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items

(after Exceptional and / or Extraordinary items)

Total Comprehensive Income for the period

[Comprising Profit / (Loss) for the period (after tax

and Other Comprehensive Income (after tax)]

respective meeting held on 30th May, 2023.

Figures have been regrouped wherever necessary.

1 Total Income from Operations

**Equity Share Capital** 

8 Earnings per equity share

(a) Basic

(b) Diluted

(Face Value of Rs.10/- per Share)

(EBIDTA)

Chatursinh

eneral Public are warned again

સહી/ અધિકૃત અધિકારી,

ANGEL ONE LIMITED

SEBI Registration No (Stock Broker): INZ000161534

AP010612 01121783

Clients are requested to contact our centralized desk 022-3355 1111/4218/5454 or email us to support@angelbroking.com

ANGEL ONE LIMITED

Read. Off: 601, 6th Floor, Ackruti Star, Central Road, MIDC, Andheri East, Mumbai - 400093

SEBI Registration No (Stock Broker): INZ000161534

**PUBLIC NOTICE** 

This is to inform/confirm that we have discontinued our Business Relations with the above mentioned Authorized

Persons, Clients and General Public are warned against Dealing in with them in his/their capacity as our Authorized

Clients are requested to contact our centralized desk <mark>022-3355 1111/4218/5454</mark> or email us to

**MAHESHWARI LOGISTICS LIMITED** 

CIN: L60232GJ2006PLC049224

Address: MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1st Phase, GIDC, Vapi-396195 Phone No. 0260-2431024, Emall: info@mlpl.biz, Website: www.mlpl.biz

Extract of Standalone and Consolidated Audited Financial Results for the

Quarter and Year ended 31st March, 2023

27,496.23

1.226.68

383.54

383.54

362.95

348.96

2,959.72

1.23

The above Audited Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in thei

The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation

33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results

are available on the websites of the Stock Exchange(s) at www.nseindia.com and the Company's website at www.mlpl.biz.

Standalone

Quarter Ended Year Ended

1.354.83

431.05

431.05

273.52

276.32

2,959.72

0.92

0.92

30,556.28 1,14,436.11

5,245.39

1.811.80

1.811.80

1.366.96

1,363.94

2,959.72

4.62

Persons and we hereby confirm that we will not be liable in any manner for any consequence of such dealings/deals

PUBLIC NOTICE

MCX/ AP/144838

NCDEX

Reg. no

Regd Address of SB/AP

Subjailsagrampura Putli Surat City 395002 Gujarat

Survey No 201, Plot No.38 Khatodara Behaind

Dealing in with them in his/their capacity as our Authorized Persons and we hereby confirm that

# વેસુમાં ત્રણયુવકો મજાકમાં પ્લાસ્ટિકની પિસ્તોલ સાથે બાઈક ઉપર ફરતા ભેરવાય **સુરત, તા.૩૧** થયો હતો. દરમિયાન વેસુ પીઆઇ એમ.સી. વેસુ વી.આઇ.પી.રોડ ઉપર જાહેરમાં વાળાના માર્ગદર્શન હેઠળ વીઆઇપી રોડના પિસ્તોલ સાથેનો એક વિડીયો વાયરલ થયો સીસીટીવી કેમેરાના ફ્રુટેજ તેમજ ટેક્નીકલ

હતો. વિડીયોમાં ત્રણ જણા નજરે પડ્યા સોર્સને આધારે તપાસ હાથ ધરી હતી. હતા. વિડીયોને આધારે પોલીસે ત્રણ જણાને પીએસઆઇ એન.ડી.વાઘેલા અને તેમની

ઝડપી પાડી તેમની પોલીસે વીડિયોને આધારે બે સગીર અલ્પેશ પુછપરછ કરતા તેમણે પોલીસે વીડિયોને આધારે બે સગીર અલ્પેશ તથા અ પ્લાસ્ટાકના પ્રસ્તાલ સાથે મનોરંજ માટે સહિત ત્રણેયને ઝડપી પાડ્યા, મનોરંજન માહિતી એકત્ર કરી સોશિયલ મિડીયા માટે વીડિયો બનાવ્યાની કબૂલાત કરી વિડીયો બનાવનાર ઉપર વિડીયો બનાવી માટે વીડિયો બનાવ્યાની કબૂલાત કરી ત્રણ જણાને પાંડેસરા

અડાજણના કાપડના વેપારીએ જીએસટી-ઇન્કમટેક્સ

ભરવાઆપેલા ૩.૮૭લાખએકાઉન્ટન્ટેપચાવીપાડ્યા

પુષા-સારોલી રોડ ઉપર આવેલી ડી.એમ. બેંક ઍકાઉન્ટમાં ટુકડે-ટુકડે કરીને

વેપારી ભાવેશ શાહને

ડી. માર્કેટના વેપારીને ત્યાં એકાઉન્ટીંગનું રૂ.૩.૮૭ લાખ ટ્રાન્સફર કરાવી લીધા

કામ કરતા એકાઉન્ટન્ટે એકાઉન્ટન્ટ ધવલ જયાણીએ હતા. ત્યારબાદ વેપારીએ જીએસટી અને એકાઉન્ટન્ટ ધવલ જયાણીએ જીએસટી અને

પોતાના અંગત કામમાં જીએસટી અને આઈટીની ભયાની ખોટી

ખોટી રસીદો બનાવી મોકલી આપવામાં આવી વેપારીને વોટ્સએપ કરી દીધી હતી

હતી.આ મામલે ભોગબનનાર વેપારીએ સારોલી અને લીધેલી ૨કમ પોતાના અંગત

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કામમાં વાપરી નાંખી હતી. આ અંગે

અક્ષર પ્લાઝામાં રહેતા ભાવેશ જગદીશચંદ્ર તેમણે સારોલી પોલીસ મથકે ધવલ

શાહ સારોલીની ડીએમડી માર્કેટમાં દિપ્તી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અમદાવાદ, તા.ડેં૧

તેમ પ્રવક્તા

મંત્ર ી ઋ ષિકેશ

પ ટેલે

જ ણા વ્યું

મહિનામાં

મળેલા 58

અંગો માં

કિડની-34,

લીવર-18,

€ E 4 - 3

ફેફસાની

હાથની

એ ક - એ ક

જોડ, અને

નાના

આંતરડાનો

સમાવેશ

મંત્રી એ

વધુમાં

જ શા વ્યુ

મુખ્ય મંત્રી

ભુપે - દ્ર

પટેલના

ने तृत्व

હેઠળ રાજય

સરકારના

SOTTO

હતુ

પ્રવક્તા

થાય છે.

એક

હતુ.

અડાજણ સરીતા સાગર સ્કુલની સામે કાપડ વેપારી ભાવેશ શાહને જાણ થતા

વાપરી નાંખ્યા હતા. વેપારીને મોબાઇલ ઉપર બોગસ રસીદો પધરાવી દીધી તેની

જુવેનાઇલ છે.

ઇન્કમટેક્ષ ભરવા માટે

આપેલા રૂ.૩.૮૭ લાખ

જીએસટી અને આઇટીની =

ક્રીએશનના નામે કાપડનો વેપાર કરે છે.

તેમને ત્યાં એકાઉન્ટીંગનું કામ કરતો ધવલ

ઘનશ્યામ જીયાણી (રહે. ભગવતી સોસાયટી,

રાધેકૃષ્ણા સોસાયટી, સરથાણા, શ્યામધામ

મંદીરની પાછળ)ને થોડા સમય પહેલા કાપડ

વેપારી ભાવેશ શાહે જીએસટી અને ઇન્કમટેક્ષ

મે મહિનામાં ગુજરાતમા

૧૯ અંગદાન થયા, ૫૮

લોકોને નવજીવન મળ્યું

ગુજરાતમાં આ મે મહિનામાં કુલ

19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58

અંગોનું સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં

ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કોઇપણ એક

મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની

પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે

REGD ADDRESS OF SB/AP

44 First Floor, Manas Nagarop

(Ct) Bharuch 392011 Gujarat

us, Zadeshwar Roadjhadeshwa

For ANGEL ONE LTD

Authorised Signator

For ANGEL ONE LTD

(Amount in Lakhs Except EPS)

Consolidated

Quarter Ended

27,651.78

1,235.23

394.36

394.30

346.0

332.04

2,959.72

1.17

Authorised Signatory

કંબુલાત કરી હતી. ઝડપાયેલા ત્રણ પૈકી બે પાસેથી ઝડપી લીધા હતા. ત્રણ પૈકી બે જણા સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મનોરંજન માટે ત્રણેયએ ભેગા મળી મોટર વેસુ વીઆઇપી રોડ ઉપર ત્રણ જણા મોટરસ સાઇકલ ઉપર પ્લાસ્ટીકની પિસ્તોલ સાથે સાઇકલ ઉપર પીસ્તોલ લઇને ફરતા હોવાનો વિડીયો બનાવી તેને સોશિયલ મિડીયા ઉપર એક વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાયરલ મુક્યો હતો.

ઇન્કમ ટેક્ષ

વિભાગમાં ટેક્ષ

બનાવી

પીડીએફ

કાપડ

રસીદો

આથી નીચે સહી કરનારની બેંક ઓફ બરોડા ના અધિકૃત અધિકારી દ્ધાર સિક્યુરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ ના ૫૪) અને સીક્યુરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ની કલમ ૧૩(૨) ના નિયમ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ તા.૧૬/૦૯/૨૦૨૨ ના રોજ કરજદારો શ્રી ઇમરાન મોહમ્મદ શેખ અને શ્રીમતી તબ્બસુમ ઇમરાન શેખ ને ડીમાન્ડ નોટીસ પાઠવી હતી. સદર નોટીસમાં દર્શાવેલી ૨કમ રૂા.૧૬,૪૯,૬७३/- જે તા.૦૮/૦૯/૨૦૨૦ના રોજ ના બાકી + તેની ઉપરનું નલાગુ પડેલ વ્યાજ + અન્ય ચાર્જાર સહિતની રકમ સદરહુ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસમાં પરત ચુકવવા જણાવ્યું હતું. કરજદારો સદરહુ રકમ પરત ચુકવવામાં નિષ્ફળ જતા કરજદારો અને જાહેર જનતા ને ચ સાથે નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સીકચુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના સેક્શન ૧૩ ના સબ-સેક્શન(૪) ના નિયમ ૮ સાથે વાંચતા મળેલી સત્તાન રૂએ અહીં નીચે જણાવેલી મિલકતનો સાંકેતિક કબજો તારીખ ૨૯/૦૫/૨૦૨૩ના દિને સંભાળ

ખાસ કરીને કરજદારો અને જાહેર જનતાને આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેમ સદરહુ મિલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહી અને કોઈપણ વ્યવહાર બેંક ઓફ બરોડ નવયુંગ કોલેજ શાખા માટે રૂા.૧૬,૪૯,૬७३/- જે તા.૦૮/૦૯/૨૦૨૨ના રોજ ના બાકી + તેર્ન ઉપરનું નલાગુ પડેલ વ્યાજ + અન્ય ચાર્જાસ સહિતની રકમની વસુલાતને પાત્ર રહેશે.

અહીં કરજદાર/જામીનદારનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે, કે જણાવેલ સમય મર્ચાદા સેક્શન ૧૩ના સબ સેક્શન (૮) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલક્તોને બાકી લેણા ભરપાઇ કરી પાછી મેળવી શકો છો. સ્થાવર મિલકતનું વર્ણન

ઈકવીટેબલ મોર્ગેજ ધર/ફલેટ નં. ૧૦૪ સુપર બિલ્ટઅપ એરીચાનું માપ ૬૭૧. ચો.ફીટ કારપેટ એરીચા ૩૬૮ ચો.ફીટ એટલે કે ૩૪.૨૦ ચો.મીટર્સ બરાબર જે ઇશરાર પેલેસ ના પહેલા માળે આવેલ જેની સાથે બિલ્ડીંગની જમીનમાં અવિભાજય હિસ્સા સહિત. જેનું બ્રાંઘકામ થયેલ જમીનનો સીટી સર્વે નોંધ નં. ૨७७० (૨७७०, ૨૨७૧, ૨૨७૨ એ, ૨૨७૨ બી, ૨૩૯૩) જે વોર્ડ નં ૧૨, સૈયદ પુરા માર્કેટ અરીયા, સુરત, તાલુકા સુરત, સીટી સુરત, જીલ્લો સુરત.

મુખ્ય પ્રબંધક અને અધિકૃત અધિકારી, તારીખ : ૨૯/૦૫/૨૦૨૩ સ્થળ : સુરત. બેંક ઓફ બરોડા, સુરત

# SURAT MUNICIPAL CORPORATION Signal Specific Science (Katargam)

E-Tender (online) Invitation Notice: DEPUTY MUNICIPAL COMMISSIONER/NZ/06/2023-24 the Tenders are invited online on https://smc.nprocure.com from Experienced Government approved contractor with following schedule:

ame of	Drainage	Housing	
epartment	Department	Department	
o.of work	01	01	
otal Estimated	34,10,835.25	1,47,10,677.00	
ost			

The details tender notice will be made available on website

www.suratmunicipal.gov.in **Deputy Municipal Commissioner** 

No. PRO/ 122 /2023-24 Date: 31/05/2023

North Zone (Katargam) **Surat Municipal Corporation** 

🎒 वैंक ऑफ़ वड़ीदा Bank of Baroda Bank of Baroda POPULATA DE TENTO

પાલનપુરપાટીયા શાખા : જી/૨-૫, મોડર્ન શોપ, સિલ્વર પ્લાઝાની બાજુમાં, રાંદેર રોડ, સુરત - ૩૯૫૦૦૯, ગુજરાત, ઈન્ડિયા ફોન નં. ૦૨૬૧-૨૭૭૫૫૨૬, ક્રમેલ : palsur@bankofbaroda.com.com

ડીમાન્ડ નોટીસ (સરફેસી એક્ટ, ૨૦૦૨ ક્લમ-૧૩ ની પેટા ક્લમ(૨) હેઠળ)

પ્રતિ, શ્રી સતિષ મનજીભાઈ દેવાણી અને શ્રીમતી ભાવિકા સતિષભાઈ દેવાણી સરતામું : ૪૬, રૂલા બંગ્લોઝ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત-૩૯૪૧૦૧ અને ભિલન્ત અહીં પણ : ફલેટ નં. સી/૧૨૦૩, સુમેરુ સ્કાય રેસીડેન્સી, મોટા વરાછા, સુરત-૩૯૪૧૦૧

શ્રી **ચિરાગકુમાર રાજ્ઞછોડભાઈ મોરડીયા (જામીનદાર),** ફ્લેટ નં. ઈ-૧/૨૦૩, ક્રિષ્ના પાર્ક એપાર્ટમેન્ટ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત - ૩૯૪૧૦૧. વિષય : સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ના કલમ ૧૩(૨) હેઠળ નોટીસ, ત્યારબાદ

ઓળખાતા ખાતાદારનું નામ : શ્રી સતિય મનજીભાઈ દેવાણી અને શ્રીમતી ભાવિકા સતિયભાઈ દેવાણી. સાહેબશ્રી, – સંદર્ભ : અમારી બેંક ઓફ બરોકા, પાલનપુર પાઠીચા શાળા, સુરતમાં ક્રેડીટ ફેસીલીડી સુવિદાઓ સાથે. (૧). વિવિધ ઋણ સુવિધાઓ અને મંજુરીની શરતો દર્શાવતા અમારા પત્ર, તા. ૧૫.૦૭.૨૦૧૬ નો અમે ઉલ્લેખ કરીએ છીએ. આ મંજુરી અન્વયે તમે અહીં જણાવેલી સુરક્ષા પાડીને ઋણ મુર્વિધાઓ મેળવીને તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે. વિવિધ લોન/ઋજ્ઞ સુવિધા એકાઉન્ટમાં હાલની બાકી રકમ અને આવી જવાબદારી માટે સિકયુરીટી ઈન્ટરેસ્ટની વિગતો નીચે પ્રમાણે છે.

ı	ફેસીલીટીનો પ્રકાર	લિમીટ	व्याषनो हर वर्षनो	બાકી લ્હેસાં તા. ૦૩.૦૫.૨૦૨૩ (તા. ૨૯.૦૪.૨૦૨૩ સુધીનું વ્યાજ સાથે)					
ı	હાઉસીંગ લોન	हा. २५,००,०००/-	8.70%	રૂા. ૨૯,७७,७૧૯.૩૬ વત્તા લાગુ ન થયેલ વ્યાજ, લીગલ અને અન્ય ચાર્જીય સાથે					
П	િારવે મુકેલ મિલકતનું વર્ણ	ion : શ્રીમતી ભાવિકા સતિ	ષભાઈ દેવાણી અને શ્રી સ	તિષ મનજીભાઈ દેવાશ્રી ના નામનો કાયદેસર ગિરવે મુકેલ મિલકતનો સ્થાવર મિલકત એટલે કે <b>ફ્લેટ</b>					
ı	ાં. ૧૨૦૩, બિલ્ટ અપ એરીયાનું ક્ષેત્રકળ ∈ € ૧.૫૦ સ્કે. ફીટ. એટલે કે ૬ ૧.૪૫ સ્કે.મી., બારમો માળ, <b>બિલ્ડીંગ ાં. સી, "સુમેરુ સ્કાચ રેસીકેન્સી"</b> , અવિભાજીત હકકને હિસ્સા								
				નલ પ્લોટ નં. ૫૭, ટી.પી. સ્ક્રીમ નં. ૨૫ (મોટા વરાછા), બ્લોક નં. ૩૯૩, રેવન્યુ સર્વે નં. ૩૯૦, <b>ગામ</b> -					
1	મોટા વરાછા, તાલુકો - સુરત સીટી, જીલ્લો - સુરત. ચલુઃસીમા :- ઉત્તરે : જોડેનો આંતરીક /બિલ્ડીંગ નં. ડી, પૂર્વે : જોડેનો કાઈનલ પ્લોટ નં. ૧૬૦, દક્ષિણે : જોડેનો સી.ઓ.પી., પશ્ચિમે :								
	-33 3-1.								

(૨). જેમ તમે જાણો છો, તમે એપ્રિલ - ૨૦૨૩ ત્રિમાસિક ગાળા માટે ઉપરોક્ત લોન / બાકી લ્હેંણી ૨કમ પરનું વ્યાજની ચુકવજ્ઞીમાં ડિફોલ્ટ થયા છો, (૩). તમે જાણો છો, ઉપરોક્ત ટર્મ લોનમાં હપ્તાઓની ચુકવણીમાં તમે ડિકોલ્ટ પ્રતિબદ્ધ થયા છે. તમારા દ્વારા બાકી રકમની ચુકવણી કસૂર થઈ હોવાથી તમારા લોન એકાઉન્ટને ભારતીય રીઝર્વ બેંકના નિયમો અને માર્ગદર્શિક પ્રમાણે તા. ૧૦.૦૪.૨૦૦૩ (એન.પી.એ. તરીકે વર્ગીકરણની તારીખનો ઉલ્લેખ કરેલ) નો રોજ નોને પરર્ફોર્મીંગ એસેટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. અમારી વારંવારની માંગણી અને વિનંતી છતાં પણ તમે વ્યાજ સહીત બાકી રકમની ચુકવણી કરી નથી ., (૪). ઉપરોક્ત કકરા નં. ૧ માં જણાવેલી વિવિધ સિક્યુરીટી દ્વારા મેળવેલ ઋણ સુવિધાઓના સંદર્ભમાં તમારી જવાબદારીઓ પુરી પાડવામાં અસમર્થ નીવડયા હોવાથી અને તમારા એકાઉન્ટને નોન પરફોંમીંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હોવાથી અમે અહીં તમે સિક્યુરીટાઈઝેશન અને રીકન્સ્ટ્રકશન ઑફ ફાયનાન્શીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એકટ - ૨૦૦૨ ની કલમ ૧૩ ની પેટા કલમ (૨) હેઠળ તમને નોટીસ આપીને ઉપરોક્ત ફકરા - ' માં જશ્નોવેલ બેંકની બાકી રકમ રૂા. ૨૬,૪૦,૪૧૯.૩૦ વતા તા. ૦૩.૦૫.૨૦૨૩ ના **સુધીનું વતા ચકત વ્યાજ વતા લીગલ અને અન્ય ખર્ચાઓના સાથે** આ નોટીસ મળ્યાના ૯૦ દિવસની અંદર ચુકવીને તમારી નાર્ણાકીય જવાબદારીઓ અદા કરવાનું તમને જણાવવામાં આવે છે. અમે તમને વધારે નોટીસ આપીએ છીએ કે, ચુકવણી તારીખ સુધી વ્યાજ સહિતની બાકીની રકમની ચુકવર્જીમાં કસુર થશે તો સરફેસીની કલમ ૧૩ ની પેટા કલમ ૪ હેઠળ ના તમામ કે કોઈ સત્તાનો ઉપયોગ કરવાની અમને ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી.. (૫). કપા કરીને નોંધ લેશો કે પૂરી રકમ ચુકવવામાં નહિં આવે ત્યાં સુધી દરેક ઋણ સુવિધા માટે કકરા - ૧ માં જણાવ્યા પ્રમાણે દરે વ્યાજ ચડવાનું ચાલુ રહેશે., (૭). અમે તમારૂં ધ્યાન આ ધારાની પેટા કલમ - ૧૩ તરફ દોરીએ છીએ જેની પરીભાષાઓ તમારી પર ફકરા - ૧ માં જણાવેલ વેચાણ, લીઝ કે અન્ય કોઈ રીતે (બિઝનેશના સામાન્ય કોર્સ સિવાય) સુરક્ષીતે સંપત્તિના નામાંતરણ કરવાનો તમારા પ પ્રતિબંધ મુકવામાં આવે છે. જેના માટે અમારી લેખિત પૂર્વ મંજુરી લેવાની રહેશે વધુમાં અમે એવું જણાવીએ છીએ કે, આ ધારાની કલમ ૧૩(૧૩) માં જણાવ્યા પ્રમાણેની જોગવાઈઓનું પાલન ન કરવું તે આ ધારાની કલમ ૨૯ હેઠળ દેડનીય અપરાધ છે., (७). અમે તમને જણાવીએ તમારૂં ધ્યાન કલમ ૧૩ ની પેટા કલમ (૮) તરફ દોરીએ છીએ, જેમાં સુરક્ષિત મિલક્ત જે ટાંચમાં લીધેલ છે તેની તમામ બાઈ સ્કમ તમામ ખર્ચાઓ સહીત બેંકની બાઈ છે તે કોઈપણ સમયે અથવા જાહેરાતમાં પ્રસિધ્ધ થયેલ તારીખના પહેલાં જાહેર હરાજી / કોટેશન મંગાવીને / ટેન્ડર મંગાવીને કે ખાનગી રાહે સોદો કરીને આવી સુરક્ષિત મિલકત રિડીગ્ડ કરાવી શકશે. એ વાતની નોંધ લેશો કે ઉપર મુજબ નોટીસ પ્રસિધ્ધ લયાના સુરક્ષિત મિલકત રિક્રીમ્ઠ કરાવાનો તમારી પાસે કોઇ અધિકાર રહેશે નહીં., (૮). કૃપા કરીને નોંધ લેશો કે આ નોટીસ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર આપવામાં આવેલ છે અને અમાર અમર્યાદિત અધિકાર કે ઉપાયના માંડવાળ તરીકે ગણવામાં આવશે. તેથી આ અંગે વધુ માંગ કરી શકીશું. જયાં સુધી પુરેપુરી રકમ ચુકવાય ન જાય.

તારીખ : ૧૫.૦૫.૨૦૨૩, સ્થળ : સુરત

પ્લોટ નંબર ૧૦૬ , દક્ષિણ– પ્લોટ નંબર ૧૦૮

ਭਿਸ਼ਵੀ ਵਿੱਸਟ

(આર.પી) (કી)



કોર્પોરેટ ઓફિસઃ ૨७/એ, ડેવેલોપેડ ઇન્દસ્ટ્રીઅલ એસ્ટેટ, ગુઇન્ડી, ચેજ્ઞાઇ, ताभिलनाडु — ५०००३२

ભાન્ય ઓફિસ : ત્રીજો માળ, ઈફ્ફકો ભવન, મારૂતિ કોમ્પલેક્ષ પાછળ, પીન્દુ ગાર્મેન્ટ પાછળ, શીવરંજની રોક પાસે, સેટેલાઈટ,અમદાવાદ-૩૮૦૦૧૫ ઓથોરાઈઝક ઓફિસર : શ્રી સૌરભકુમાર નાપીત E-mail: saurabhkumar@hindujahousingfinance.com

## નિયમ ૮ (૬) અને ૯ (૧) હેઠળ સિક્ચોર્ડ અસ્ક્ચામતની જાહેર હરાજી વેચાણ નોટીસ ક્મ ટેન્ડર

હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્સ લિ.ના સિક્ચોર્ડ લેણા તે અધિકૃત અધિકારીએ તે નીચે કોલમ નં. (સી) માં આપેલ બાકી રકમ અને કોસ્ટ અને ચાર્જેર સહીત આગળના વ્યાજની વસૂલાત માટે ધી સિક્યોરિટાઇગ્રેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ હેઠળ પોતાને મળેલ અધિકારોની રૂએ નીચે જણાવેલ સિક્યોર્ડ અસ્ક્યામતના લીધેલ ક્વજાના અનુસંધાને, દેણદારો/સહ-દેણદારો પાસેથી લેવાની થાય છે. નીચે હસ્તાક્ષર કરનાર દ્વારા જેમ છે જ્યાં છે, જે છે તે છેના આધારે અને જે કાંઇ છે તે છેના આધારે અહીં વર્ણન કરેલ, ક્રિપ્રિકલ કુબલમાં રહેલ સ્થાવર મિવકનની ખરીદી માટે બંધ કરાગ્યાં ઓક્ર્સ્ગ મેગાનવામાં આવે છે. એને કંક્યાં દિવસો નીચે પાલન છે ાં ઓફ્ટો મંગાવવામાં આવે છે, જેની ટૂંકમાં વિગતો નીચે મુજબ છે

કિઝિસ્લ સ્બહ્યમાં કહલ ક્લાવક 1મલસ્વના ત	મરાદા માટ બદા કવરમાં આફરા મગ
ઉદ્યારકર્તાઓ, અને	કિમાન્ક નોહિસ તારીખ,
સહ-ઉદ્યારકર્તાઓ અને	રકમ અને લોન ખાતા
જમીનદારો ના નામ (એ)	નંબર અને શાખા (સી)
ઉદ્યારકર્તા :-	Dt. 11-03-2022
પ્રકાશ સુદાની	&
સહ-ઉદ્યારકર્તા :-	Rs.74,80,924/-
ભરત સુદાની	&
સહ-ઉદ્યારકર્તા :-	A/C No.
મેદ્યના સુદાની	GJ/AMD/GDDM/A000000007

અનેંસ્ટ મની ડિપોઝીટ

(ઈએમડી) (આરપીના ૧૦%) (ઈ

सुरत डिस्ट्रिक्ट रेशुस्ट्रेशन सज डिस्ट्रिक्ट तालुको कामरेजन હાલ સુરત સિટીના મોજે સરથાણાના બ્લોક નંબર ૪૨ ટી.પી. નંબર ૨૧ તથા એફ.પી. નંબર ૮૪ થી નોંધાયેલ રહેણાંકના હેતુ માટેની બિન ખેતી જમીનમાં આયોજન કરવામ આવેલ ગણેશ રો હાઉસ નામની સોસાયટીમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નંબર ૧૦૭ થી નોંધાયેલ સંપૂર્ણ બાંધકામ વાળી મિલકત. જેનું કુલ ક્ષેત્રફળ સુમારે ૭૧ ચો.મીટર છે.જેમાં સંપૂર્ણ બાંધકામનું કુલ ક્ષેત્રફળ દુપ ચો. મીટર છે તેને લાગુ રોડ રસ્તાના વણવેહચાચેલા હિસ્સાનું તથા સી.ઓ .પી નું ક્ષેત્રફળ

મિલકતનું પરિશિષ્ઠ (બી)

હરાજીની તારીખ અને ટેન્ડરો ખોલવાનો સમય (જી)

dl. 08-06-5053

રૂા. ૫,૧૧,૦૬૦/-३।. ५१,१०,५०४/-(અંકે રૂા. એક્કાવન લાખ (અંકે રૂા. પાંચ લાખ સમય : બપોરે ૧૨-૦૦ સમય : બપોરે ૨-૦૦ દસ હજાર છસો ચાર પુરા) અગીચાર હજાર સાહીંટ પુરા) થી ૪-૦૦ સુધી કલાકે

भिલક्तना निरीक्षणनी तारीज

અને સમય (એફ)

dl. 28-09-2023

રહ.૮૮ ચો.મીટર મળી ફુલ ક્ષેત્રફળ ૯૮.૮૮ ચો.મીટર પ્લોટ વાળી મિલકત્ત. જેની ચતુઃદિશા નીચે મુજબ છે. પૂર્વ – પ્લોટ નંબર ૯૬ પશ્ચિમ – રોડ , ઉત્તર

તથા, સિક્ચોર્ડ ક્રેડિટર હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડના અધિકૃત અધિકારીએ સદરહુ સિક્ચોર્ડ અસ્ક્ચામતનો નિકાલ કરવાનુ નક્કી કરેલ છે. વેચાણની આ નોટિસ આજે પ્રકાશિત થયેલ છે કે ઉપરની વિગતની સિક્ચોર્ડ અસ્ક્ચામતોનું ૦૪–૦૭–૨૦૨૩ના રોજ ઉપર જણાવેલ સમયે અને શિક્યૂલ મુજબ હિન્દૂજા હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ, બ્રાન્થ ઓફિસ : ત્રીજો માળ, ઇફ્ફકો ભવન, મારૂંતિ કોમ્પલેક્ષ પાછળ, પીન્દૂ ગાર્મેન્ટ પાછળ, શીવરંજની રોડ સેટેલાઈટ,અમદાવાદ-૩૮૦૦૧૫. ખાતે વેચાણ થશે. ઊરવેદાર ખાસ નોટિસી અને જાહેર જનતાને સામાન્ય રીતે આથી ચેતવણી આપવામાં અને મનાઈ કરમાવવામાં આવે છે કે સદર કાયદાના એક્ટ

૧૩(૧૩) ની શરતો મુજબ સદર સિક્યોર્ડ અસ્ક્યામત સાથે કોઈ પણ રીતે વ્યવહાર કરવો નહીં અને આવો કોઈ પણ વ્યવહાર હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્થ લિમેટેર્ડના રકમો અને આગળના વ્યાજ સહિત થતા ચાર્જને આધીન રહેશે. ગિરવેદારો ખાસ નોટિસીને ૦૩-૦૭-૨૦૨૩ (તારીખ) ના સાંજના ૫.૦૦ (સમય) અગાઉ ત્યાં સુધી થતા વ્યાજ સહિત તમામ લેણી ૨૬મ ચૂકવી જવાની છેલ્લી તક આપવામાં આવે છે જેમાં કસૂર થયેથી સિક્ચોર્ડ અસ્કથામતનું શિડ્યૂલ મુજવ અહીં ઉપર કોલમ (ક)માં દર્શાવેલ સિક્ચોર્ડ અસ્ક્યામતની વિગતો નીચે સહી કરનારની શ્રેષ્ઠતમ જાણકારી અને જ્ઞાન મુજબ જણાવેલ છે, જેવ

આ વિગતોમાં કોઈ પણ ભૂલ, ગેરનિવેદન કે રહી ગયેલ હોય તે માટે જવાબદાર ગણાશે નહીં. ટેન્ડરર(રો)/ઓફરર(રો) પ્રોરપેક્ટિવ બીડર(રો) / ખરીદદાર આ વેખાના કાઇ વહા જૂવા, ગામનાગરના કરવા વેપાય હોવા તે માટે અવાબદાર બોલા છે છે. (રો)ને અને સૂચિત કરવામાં આવે છે કે સિક્ચોર્ડ અસ્ક્ચામત સ્ટેચ્ચુટરી ઓથોરિટીને ચુકવવાપાત્ર કરવામારણો અને દેણા (જો કોઈ હોય તો) તે સહિત્ વેચાશે અને તેમને વિનંતી કે પોતાના હિતમાં, પોતાના સંતોષ ખાતર ઉપરના સંદર્ભે અને ઉપર જણાવેલ સિક્ચોર્ડ અસ્ક્ચામત અંગે અન્ય સંબંધિત વિગતોર્ન ખરાઈ ટેન્ડર જમા કરાવતા અગાઉ કરી લેવી.

ટેન્ડરર(રો)/ઓફરર(રો) પ્રોસેક્ટિવ બીડર(રો)/ ખરીદદાર(રો) એ પોતાની ઓફર કેવાયસી અને ઉપર જણાવેલ અર્નેસ્ટ મની ડિપોઝીર (ઇએમડી) સાથે બંધ ક્વરમાં "મિલકતની ખરીદી માટે ઓફર" એમ ક્વર પર લખીને શાખા ઓફિસે ઉપર જણાવેલ હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ (શિમારા) સાથ પાલ કવરના 'મલકલના ખરાદા નાટ આર્ફર' અને કવર વર લગાગ સારા આવ્યું હતું કાર્યાના હતું ને કાર્યાના સાર ત્રીજો માળ, ઇફ્ફકો ભવન, મારૂતિ કોમ્પલેસ પાછળ, પીન્દુ ગાર્મેન્ટ પાછળ, શીવરંજની રોડ પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫. (સરનામું) ખાતે ૦૪–૦૭–૨૦૨૩ના રોજ ળપોરના ૨.૦૦ પહેલા મળી જાય તેમ જમા કરાવવાના રહેશે. ઇએમડી રાષ્ટ્રીયકૃત /શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકના "હિન્દુજા હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ"ની તરફેણમાં ચેક્ષઇ ખાતે ચૂકવવાપાત્ર ડીડી /પીઓથી મોકલવી. નિરીસણ, હરાજીની શરતો અને નિયમો, ટેન્ડર જમા કરાવવા સંદર્ભે કોઇ વધુ સ્પષ્ટીકરણ માટે મહેરબાની કરીને <sup>°</sup>સૌરભકુમાર નાપીત બીડનો મોબાઇલ નં. ૭૮૭૪૮૨૮૭૮૯ અને હીતેષકુમાર પટેલ બીડનો મોબાઇલ નં. ૭૮૭૮૭૧૭૧૭૨ પર સંપર્ક કરવો. જે ટેન્ડરોની કંપની દ્વારા કટ ઓફ ટાઇમ પહેલા પૂરતી વિગતો સહિત ઓફિશ્ચલ અને રૅજિસ્ટર્ડ રીતે જાણ કરાશે તેને ୫ଥାଖି भाटे ध्याने લેવાશે. અધિકૃત અધિકારી કોઈ પણ અથવા તમામ બીડ્સ કોઈ પણ કારણ આપ્યા વિના ૨૯ કરવાનો અબાધિત અધિકાર રાખે છે સફળ બીડરે રજિસ્ટ્રેશન ફી, સ્ટેમ્પ ડ્યૂટી વગેરે જેવા કાયદેસર લાગુ પડતા ચાર્જેસ /કન્વેયન્સ માટે ચૂકવવાપાત્ર ફી વગેરે ભોગવવાના રહેશે. વેચાણનું સર્ટિફિકેટ ખરીદદાર/બીડરના નામે જ આપવામાં આવશે, અન્ય કોઇ નામથી નહીં. ખરીદદારે સ્ટેમ્પ ડ્યૂટી, રજિસ્ટ્રેશન ચાર્જેસ અને અન્ય તમાર

સંલગ્ન ફીઝ, ડ્યૂટીઝ, ટેક્સ વગેરે વેચાણના સર્ટિફિકેટ સંદર્ભે થતા ખર્ચા ભોગવવાના રહેશે. સફળ બીડર ખરીદદારે વેચાણ પ્રક્રિયા પર આવકવેરા, ૧૯૬૧ ના સેક્શન ૧૯૪(૧–એ) મુજબ ૧% ના દરે ટીડીએસ કાપવાનો રહેશે અને ફોર રદ્દ કચુબી માં ચલન દર્શાવીને જમા કરાવવાનો રહેશે તથા ટીડીએસ સર્ટિફિકેટની અસલ રસીદ હિન્દુજ હાઉસીંગ ફાઇનાન્સ લિમેટેડને (રૂ. ५०.०० લાખ અને ઉપરની મિલકત) જમા કરાવવાની રહેશે.

અધિકૃત અધિકારી કોઈ પણ અથવા તમામ બીડ્સ કોઈ પણ કારણ આપ્યા વિના રદ કરવાનો અબાધિત અધિકાર રાખે છે. અધિકૃત અધિકારી **હिन्दु**क्ष ढाઉसिंग झाछनान्स विभिटेड 😱શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બાબેન-બારડોલી પો. સરદારબાગ -૩૯૪૬૦૧, તા. બારડોલી, ર્જી. સુરત ခ့ါन नं. ၀२६२२-२२०९७२, २२०९७३, ခွဲဆုံး २२०४४३, E.mail: sfb

#### ः हेन्डर ः

સુરત જીલ્લામાં સમાવિષ્ટ તમામ સહકારી ખાંડ મંડળીઓ તેમજ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., વટારીયાએ વર્ષઃ ૨૦૨૩-૨૦૨૪ માં AGR-02 યોજન અંતર્ગત સામૂહીક ઉદર નિયંત્રણ માટે **'બ્રોમોડીઓલોન, આર.બી. અને સી.બી.** દવાઓ ખરીદવાની હોય, જરૂરી ટેન્ડર જે તે ખાંડ મંડળીઓની પરચેઝ ઓફિસમાંથી મેળવી, ભરેલા ટેન્ડર **તા. ૦૯.૦૬.૨૦૨૩ ને સાંજે ૪.૦૦ વાગ્યા** સુધીમાં જે તે ખાંડ મંડળીઓને સીલબંધ કવરમાં મોકલી આપવાનાં રહેશે. ટેન્ડર આપવા/સ્વીકારવાનો સંસ્થાનો હકક જે તે સંસ્થાઓનો અબાધિત રહેશે. બારડોલી

તા. ૩૧.૦૫.૨૦૨૩

એચ.પી. સિંહ ઈ.ચા.મેનેજીંગ ડીરેક્ટર

गुळशत गाडिंशन

આર. આર. બોરડ, સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટશ્રી, નવસારીની કોર્ટમાં નં.એમએજી/મરણ પ્ર./રજી નં. ૧૧૯/૨૦૨૩ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ્ર નવસારીની કચેરી, અરજદાર: શ્રી સખીબેન ઈશ્વરભાઈ રાઠોડ રહે. વીસગાળા, ચોવીસી, તા. જી. નવસારી વિરૂદ્ધ તાલુકા સેવા સદન, કાલીયાવાડી, નવસારી સામાવાળાઃ સબ રજીસ્ટ્રાર, જન્મ-મરણ, નવસારી-વિજલપોર

નગરપાલિકા, નવસારી જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ની ક્લમ-૧૩(૩) અન્વરે મરણની નોંધ કરાવવા માટેનો હુકમ

મેળવવા માટેની અંરજી અન્વચે નોટીસ આવી લાગતા-વળગતા ઈસમોને જણાવવાનું કે, વાદીએ જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, વાદી

શ્રી સુખીબેન ઈશ્વરભાઈ રાઠોડ ના સસરા ભાણાભાઈ મંગાભાઈ હળપતિ નું મરણ તા. ૨૦-૦૩-૧૯૯૧ ના રોજ મોજે: નવસારી, તા. જી. નવસારી ખાતે થયેલ છે અને તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાની અજાણ હોઈ ભુલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર અરજીના અનુસંધાનમાં કોઈ ઈસમને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત જાહેરાત પ્રસિધ્ધિની તારીખથી દિગ-૦૭ ની અંદર નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નવસારીની કચેરી ખાતે વાંધો યા તકરાર રજુ કરવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં કસુર કરશો તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની તમામ લાગતા-વળગતા (આર. આર. બોરડ) સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ - નવસારી ઈસમોએ નોંધ લેવી.

इंडियन बैंक 🛮 🚯 Indian Bank

અડાજણ શાખા, યુજી-1, સંઘવી ટાવર, અડાજણ-હજીરા રોડ, સુરત. ફોન : 7905867925. E-mail: adajan@indianbank.co.in

કબજા નોટીસ [રૂલ 8(1) સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ, 2002 ફેઠળ]

ાથી નીચે સહી કરનાર ઈન્ડિયન બેંક, અડાજણ શાખા, યુજી-1, સંઘવી ટાવર, અડાજણ, સુરત, ગુજરાત પીન-395009ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, 2002 (54 ઓફ 2002)તથા સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ) નિયમો. 2002ના નિયમ 13(12) સહિત રૂલ નં 3 હેઠળ મળેલ સત્તાની રૂએ તા.25-07-2022ના રોજ કરજદાર/મોર્ટગેજર શ્રી રાજેન્દ્રપ્રસાદ યાદવ અને શ્રીમતી સુનિતા રાજેન્દ્રપ્રસાદ યાદવને હિમાન્ડ નોટિસ પાઠવી હતી. સદર નોટીસમાં પાઠવેલી રકમ **રૂા.૧,4**7,848.00/-(**રૂપિયા નવ લાખ સુડતાલીસ હજાર આઠ સો** અડતાલીસ રૂપિયા પૂરા) તા. 25-07-2022ના રોજ તથા તા.26-07-2022 થી આગળનું વ્યાજ અને અન્ય **ખર્ચાઓ** સાથે સદરહુ નોટિસ મળ્યાની તારીખથી 60 દિવસમાં પરત ચુકવવા જણાવાયું હતું.

કરજદાર સદરહ રકમ ચકવવામાં નિષ્ફળ જતાં કરજદાર/જામીનદાર અને જાહેર જનતાને આ સાથે નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ 2002ના સેક્શન 13(4)ના નિયમ 8 સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે જણાવેલી મિલકતનો પ્રત્યક્ષ કબજો તા. 27-05-2023ના દિને સંભાળી લીધેલ છે

. ૨૪૬ા૨/જામીનદા૨/મોર્ટગેજ૨ અને જાહે૨ જનતાને આથી જાહે૨ ચેતવણી આપવામાં આવે છે કે તેમણે સદ૨હુ મલકત બાબતમાં કોઈ વ્યવહાર કરવો નહીં અને કોઈપણ વ્યવહાર **ઈન્ડિયન બેંક, અડાજણ શાખા, યુ**જી-1, સંઘવી ટાવર, અડાજણ, સુરત, ગુજરાત. પીન-395009 માટે રૂા.9,47,848.00/- (રૂપિયા નવ લાખ સુડતાલીસ હજાર આઠ સો અડતાલીસ રૂપિયા પૂરા) તા. 25-07-2022 ના રોજ તથા તા.26-07-2022 **ી બેંક દ્વારા કરવામાં આવેલ વ્યાજ અને ઓકસ્મિક ખર્ચાઓ** સાથે મળી વસુલાતને પાત્ર રહેશે.

અહીં કરજદારનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે કે, જજ્ઞાવેલ સમય મર્યાદામાં સેકશન 13 ના સબ સેક્શન (8) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતોને બાકી લેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો. સ્થાવર મિલકતનું વર્ણન

તમામ ભાગ અને હિસ્સો ધરાવતી મિલકત પ્લોટ નં. 114, પ્લોટ એરિયા 40.18 ચો.મી., રસ્તા અને સીઓપીમાં અવિભાજીત પ્રમાણસર હિસ્સા સાથે માપ 36.42 ચો.મી., આરાધના સ્કાય પાર્ક વિભાગ-3, રેવન્યુ સર્વે નં. 339, બ્લોક નં. 351, ગામ કારેલી, તા.પલસાણા, જી. સુરત, સબ ડિસ્ટ્રી. પલસાણા ખાતે સ્થિત. જેની ચતુર્સિમા: ઉત્તર: લાગુ પ્લોટ નં. 113, દક્ષિણ : લાગુ પ્લોટ નં.115, પુર્વ : લાગુ પ્લોટ નં. 105, પશ્ચિમ : લાગુ સોસાયટીનો આંતરિક રસ્તો*.* અધિકૃત અધિકારી, ઈન્ડિયન બેંક તારીખ : 27-05-2023 | સ્થળ : સુરત

#### **ZOTA HEALTHCARE LIMITED**

Registered Office: Zota House, 2/896, Hira Modi Street, Sagrampura, Surat-395002, Gujarat Email: info@zotahealthcare.com Website: www.zotahealthcare.com Ph: +91-261-2331601 EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND

	TEAR E	1DED MARON 31, 2023			(Rs. in Lakhs, except per share data)		
Sr.	Particulars	STANDALONE			CONSOLIDATED		
No.		Quarter ended March 31, 2023 (Audited)	Year Ended March 31, 2023 (Audited)	Quarter ended March 31, 2022 (Audited)	Quarter ended March 31, 2023 (Audited)	Year Ended March 31, 2023 (Audited)	Quarter ended March 31, 2022 (Audited)
1	Total Income from operations	3625.74	13836.60	3175.26	3684.89	13995.69	3133.64
2	Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items)	13.41	808.50	44.81	(363.18)	(522.89)	(99.43)
3	Net Profit for the period before tax (after exceptional and /or extraordinary items)	67.20	862.29	44.81	(309.39)	(469.10)	(99.43)
4	Net Profit for the period after tax (after exceptional and /or extraordinary items)	65.41	659.35	34.74	(263.48)	(577.28)	(101.09)
5	Total Comprehensive income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	85.79	686.27	40.98	(242.40)	(549.61)	(94.78)
6	Paid-up Equity Share Capital (face value of Rs.10/- each)	2516.03	2516.03	2516.03	2516.03	2516.03	2516.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		6930.28			5519.64	
8	Earnings Per Share (face value of Rs. 10/- each) (for continuing and discontinued operations)  1. Basic: 2. Diluted:	0.26 0.26	2.62 2.62	0.14 0.14	(1.05) (1.05)	(2.29) (2.29)	(0.40) (0.40)

1. The above is an extract of the detailed format of Quarterly and Year to Date Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Year to Date Financial Results are available on the websites of the National Stock Exchange of India at ndia.com and on the website of the Company at the www.zotahea

The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held or May30,2023. The Audit as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure

Requirements Regulations, 2015 has been completed by the auditors of the Company.

The Board of Directors in its meeting held on May30, 2023 has recommended the final dividend at the rate of 10 % i.e. Re. 1/- per equity share for the financial year 2022-23, subject to the approval of shareholders at the ensuing Annual General meeting of the Company.

Ashvin Variya (Company Secretary & Compliance Officer) Place : Surat. Date : 31-05-2023 For and on behalf of Board of Directors of Zota Healthcare Limited

## પંથ ઈન્ફીનીટી લીમીટેડ

(CIN: 145201G11993PLC114416)

રજી. ઓફિસઃ ૧૦૧, સિધ્ધ ચેમ્બર્સ, તરતીયા હનુમાન શેરી, ગુર્જર ફળીયા, હરીપુરા, સુરત-૩૯૫૦૦૩, ગુજરાત. Tel.: 7043999011, Email: info@panthinfinity.com, Website: www.panthinfinity.com 39 મી માર્ચ ૨૦૨૩ ના રોજ સમાપ્ત થયેલા ત્રીમાસીક અને અર્ધવાર્ષિક સમયગાળાના અલાયદા અનઓડીટેડ નાણાંકીય પરીણામોનો સાર

	्रिया वालाना व वर्णात स्वापन						
_	વિગત	ત્રીર	ાસીકની સમ	વાર્ષિક સમાપ્તી			
용		39.03.2023	39-92-2022	39.03.2022	39.03.2023	39.03.2022	
•1		रीक्र नोट र	(හනෝදිස්ද)	रीक्र जोट र	(නනෝදි) ද්ර	રીફર નોટ ર	
٩	સંચાલન માંથી કુલ આવક (ચોખ્ખી)	945.05	292.U9	366.44	9466.63	9846.66	
5	સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નકો / (ખોટ) (કરવેરા પહેલા, અપવાદીત અને / અથવા અસાઘારણ વસ્તુઓ પહેલા)	(44.38)	50.35	(s.64)	29.90	(0.00)	
3	કરવેરા પહેલાના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / ખોઢ (અપવાદીત અને / અથવા અસાદારણ વસ્તુઓ પછી)	(354-68)	90.32	(5.64)	(553.63)	<b>u</b> .99	
8	કરવેરા પછીના સમયગાળા દરમિયાનનો ચોખ્ખો નફો / (ખોટ) (અપવાદીત અને / અથવા અસાદારણ વસ્તુઓ પછી)	(568.36)	84.86	(0.60)	(553·A8)	8.50	
ч	સમયગાળાની કુલ વ્યાપક આવક (સમયગાળા દરમિયાનનો વ્યાપક નફો/(ખોટ) (કરવેરા પછી) અને અન્ય વ્યાપક આવક (કરવેરાપછી)	(568.88)	84.86	(८७.५९)	(553.55)	(८५.५४)	
ç	ઇક્વીટી શેર કેપીટલ (પ્રતિ શેર રૂા.૧૦/– ની મૂળ કિંમત)	4585.55	4585.55	9535.40	4585-55	9535.40	
9	ભંડોળ (ગયા વર્ષની ઓડિટેક પાકા સરવૈયા માં દર્શાવ્યા મુજબ પૂન:મુલ્યાંકિત ભંડોળ બાદ કરતા)	H-3	:-	-	64.55	690.40	
c	શેર દીઠ આવક (પ્રત્યેક શેર રૂા.૧૦/– મુજબ) (સતત અને બંધ કામગીરી માટે)						
	(અ) મૂળ ઇપીએસ (બ) ભેગી ઇપીએસ	(q.50) (q.50)	0.24	-0.09 -0.09	(4·54)	50.0	

પુકાશિત વર્ષ-ટુ-કેટ આંકડાઓ વચ્ચેના સંતુલિત આંકડા છે, 2022 એ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના અંતની તારીખ છે જે વૈદ્યાનિક ઓડિટર્સ દ્વારા મર્યાદિત સમીક્ષાને આધિન છે.

3.31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને વર્ષ માટે કંપનીના ઉપરોક્ત ઓડિટેડ નાણાકીય પરિણામો કંપનીઓની કલમ 133 ફેઠળ નિર્ધારિત ૃ્લાગુ ભારતીય એકાઉન્ટિંગ ઘોરણો ("ઇન્ડ એએસ") માં નિર્ધારિત માન્યતા અને માપન સિદ્ધાંતો અનુસાર તૈયારે કરવામાં આવ્યા છે. અધિનિયમ, 2013, સંશોધિત તરીકે, તેના હેઠળના સંબંધિત નિયમો સાથે વાંચો અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન,2015 ના નિયમન 33 ની શરતોમાં.

4. કંપનીને 11.04.2023 ના રોજ CSE લિમિટેડ તરફથી 61,57,228 બોનસ ઇક્વિટી શેર માટે લિસ્ટિંગની

5.31મી માર્ચ,2023 સુધી રોકાણકારોની કોઈ ફરિયાદ બાકી નથી.

સ્થળઃ સુરત

dl.: 30-04-2023

6. કંપની હીરા અને જ્વેલરીના વેપારના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આથી, ભારતીય એકાઉન્ટિંગ ધોરણો 108ના સંદર્ભમાં કોઈ અલગ રિપોર્ટિંગ સેગમેન્ટ નથી.

7. 30 મે, 2022ના રોજ બોર્ડ દ્વારા યોજાયેલી તેની બેઠકમાં અને કરાયેલી ભલામણના અનુસંઘાનમાં અને કંપનીના શેરઘારકો દ્વારા 4 જુલાઈ, 2022ના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા રિમોટ ઈ-વોટિંગ દ્વારા મંજૂરી આપવામાં કપ્તાના શરિલા કર્યું હોય 4 યુલાઇ, 2022ના કર્યું કર્યા હવે હોય દિવસ કર્યા હોય તે કર્યું કર્યા અપ્તાની કર્યો છે. આવી કર્તી, કંપનીએ 1:2 ના ગુણીત્તરમાં 3. 10/- પ્રત્યેકની ફેસ વેલ્ટુ ધરાવતા 61,57,228 સંપૂર્ણ પેઇંડ-અપ બોનસ ઇક્વિટી શેર જારી કર્યા છે એટલે કે બે સંપૂર્શ યૂકવેલ ઇક્વિટી શેર માટે એક બોનસ ઇક્વિટી શેર. બોનસ ઇશ્યૂના પરિણામ, કુલ પેઇંડ-અપ શેર મૂડી વધીને 3. 18,48,22,280/- થી 3. 12,32,50,000/- તે પ્રમાણે, Ind AS 33 મુજબ - શેર દીઠ કમાણી, પ્રસ્તુત સમયગાળા માટે શેર દીઠ મૂળભૂત અને પાતળી કમાણીની ગણતરી મેળ બેસાડેમાં આવી છે અને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

8. કંપની પાસે કોઈ પેટાર્કપની, સહયોગી અથવા સંયુક્ત સાહસ નથી; તેથી, તેથી માત્ર એકલ પરિણામો જ તૈયાર કર્યા છે કારણ કે એકત્રીકરણની જરૂરિયાત કંપનીને લાગુ પડતી નથી.

9. વર્તમાન સમયગાળા/વર્ષના વર્ગીકરણની પુષ્ટિ કરવા માટે જરૂરી હોય ત્યાં અગાઉના અર્ધ વર્ષ/વર્ષન આંકડાઓ ફરીથી જૂથબદ્ધ/પુનઃવર્ગીકૃત કરવામાં આવ્યા છે. પંચ ઈન્ફીનીટી લીમીટેક, વર્તી

સહી/-ગુષ્ણભાદ્ય મસવાણા ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર DIN: 09756503

Place: Vapi Date: 30.05.2023

On behalf of the Board of Directors of

MAHESHWARI LOGISTICS LIMITED

Sd/-Vinay Maheshwari DIN: 01680099

0.91

0.91

4.56

4.56

એ કમને 31.03.2023 31.12.2022 31.03.2023 31.03.2023 31.12.2022 31.03.2023 વડાપ્રધાન 30,837.09 1,14,904.79 ન રેન્દ્ર મોદીના 1,360.87 5,257.15 434.50 1.823.22

હ ૨ તે તાજેતરમાં મળેલ 8 434.50 1,823.22 એવોર્ડ થકી 270.49 1,348.20 રાજ્યમાં અંગદાનની સેવાકીય 273.29 1,345.19 પ્રવૃતિ સાથે 2,959.72 2,959.72 સંકળાયેલા

> તમા મ લો કો ને પ્રોત્સાહન U

છે. આ બહુમાન એ રાજ્યમાં

અંગદાનની સેવાકીય

પ્રવૃત્તિમ પ્રાણ ફુંક્યો છે.

स्थण : सरत તારીખ : ૦૧-૦૬-૨૦૨૩